

Date: 12.08.2024

To,
Department of Corporate Services
BSE Limited
P J Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001

Scrip Code: 524748

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement of Unaudited Financial Results for the Quarter ended 30th June,2024

Pursuant to the provisions of Regulation 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of newspaper advertisements for the Extract of unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2024:

01. Business Standard (English Edition) dated 10th August, 2024 and
02. Loksatta (Gujarati Edition) dated 10th August, 2024

You are requested to take the same on your record.

Thanking you,

Yours truly,
For Link Pharma Chem Limited

Khushbu Patel
Company Secretary & Compliance Officer
Membership No.: A65182

Encl: As above

REGISTERED OFFICE:

Plot No., 162, G.I.D.C., Nandesari - 391340, Dist. Vadodara (Gujarat) (India)
Tel. (O) 87806 04490 E-Mail: linkpharmacs@gmail.com
CIN: L24230GJ1984PLC007540 Website: www.linkpharmachem.co.in

HINDUJA HOUSING FINANCE

Corporate Office : No. 167-169, 2nd Floor, Anna Salai, Saidapet, Chennai-600015
Branch Office : 3rd Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015.
Saurabhkumar Napat No.7874828789, Vikas Savariya No. 7984982904, Bunty Ramrakhiyani No. 9029004701
Hitesh Kumar Patel No.7048336601, Sushil Chaudhary No. 8118818160, Nitin Samudre M. 8128310678, Shivam Mishra M. 9033015277 Rajesh Dangar M. 777900058.

Possession Notice - As per Appendix IV

Whereas, The undersigned being the Authorized Officer of Hinduja Housing Finance Limited (HHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued the Demand Notice under section 13(2) calling upon the borrowers to repay the amount mentioned in the notice alongwith further charges, interest etc. within 60 days from the date of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002.

Name of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount Loan Account No	Date of Possession	SCHEDULE OF THE PROPERTY
1. BORROWER: MR. BHANUPRASAD JAISWAL & CO-BORROWER: MRS. REKHABEN JAISWAL	Dt. 10/05/2024 & Rs. 8,29,366/- A/C No. GJ/MSN/HMTN/A000000142	07-08-2024	All that pieces and parcels of immovable property having Village: Hathoj, Gram Panchayat Hathoj Aakarni Milkat No. 76 area admeasuring. 392.98 Sq. Mt. of bearing of situated at village Hathoj under the limits of Hathoj Gram Panchayat Ta. Vadali Dist. Sabarkantha Boundary of the captioned property: EAST - Property of Ishvarji Sardarji WEST -Property of Jashiben NORTH - Road SOUTH- Road
2. BORROWER: MR. FARUKBHAI MEMAN & CO-BORROWER: MRS. TASLIMABANU MEMAN	Dt. 10/05/2024 & Rs. 10,53,280/- A/C No. GJ/MSN/HMTA/A000000016	07-08-2024	All that pieces and parcels of immovable property having of Village Savgad S. No. 298 Paiki Plot No. 1 Paiki Middle Part House area admeasuring. 63.60 Sq. Mts. bearing situated at Village Savgad under the limits of Savgad Gram Panchayat Ta. property: EAST - Plot no. 1 Paiki WEST - S. no. 298 Paiki Road NORTH - Plot no. 1 Paiki SOUTH - Plot no. 1 Paiki
3. BORROWER: MR. VANRAJINSINH PARMAR & CO-BORROWER: MRS. HETALBA PARMAR	Dt. 10/05/2024 & Rs. 8,00,708/- A/C No. GJ/MSN/HMTN/A000000086	07-08-2024	All that pieces and parcels of immovable property having Village: Kenpur, Grup Gram Panchayat Rampur (Gho.) Aakarni Milkat No. 41 P 1 area admeasuring. 222.9675 Sq. Mt. of bearing of situated at village Kenpur under the limits of Rampur (Gho.) Boundary of the captioned property: East: Road, West- Road, North - House of Ratansinh Ramsinh, South - House of Zalamsinh Motisinh
4. BORROWER: MR. KALUBHAI VAGADIYA & CO-BORROWER: MRS. LILABEN VAGADIYA	Dt. 10/05/2024 & Rs. 10,79,683/- A/C No. GJ/MSN/HMTA/A0000000141	07-08-2024	All that pieces and parcels of immovable property having of Village Khalikpur S. No. 16/2 Paiki, Plot No. 5, 6 "Krishna Residency" Block C, 3rd Floor Flat No. C-306 area admeasuring 51.66 Sq. Mts. bearing situated at Village Khalikpur under the limits of Khalikpur Gram Panchayat Ta. Modasa Dist. Arvalli.
5. BORROWER: MR. KAMLESHKUMAR DASVANI & CO-BORROWER: MRS. ROSHANIBEN DASVANI & GUARANTOR: MR. RAVINDRAKUMAR PATEL	Dt. 10/05/2024 & Rs.15,50,385/- A/C No. GJ/MSN/HMTN/A000000125	07-08-2024	All that pieces and parcels of immovable property having of Village Khalikpur Survey No. Old 16/2 Paiki (New S.no.29) Plot No. 5, 6 "Krishna Residency" Block - D, 3rd Floor Flat No. D-5 (D-305) area admeasuring. 63.21 Sq. Mts. bearing situated at Village Khalikpur under the limits of Khalikpur Gram Panchayat Ta. Modasa Dist. Arvalli.
6. BORROWER: MR. MAHAMMED SARFARAZ SHAIKH & CO-BORROWER: MRS. NAJERABANU SHAIKH	Dt. 10/05/2024 & Rs.19,27,224/- A/C No. GJ/MSN/HMTA/A000000042	07-08-2024	All that pieces and parcels of immovable property having of Village Sayara S.no. 862/1 (New S.no. 249) "Dwarka Puri Township" Block-A, 3rd Floor Flat no. 405 area admeasuring. 91.61 Sq. Mts. bearing situated at village Sayara under the limits of Sayara
7. BORROWER: MR. ANILBHAI SOLANKI & CO-BORROWER: MRS. URMILABEN SOLANKI	Dt. 10/05/2024 & Rs.10,22,834/- A/C No. GJ/AMD/AHMD/A000000525	08-08-2024	All Parts and parcels of Property bearing House No.33,admeasuring about 52 Sq. Yards Construction area in the scheme known as "Ranujanagar Society" Situated at Nikol Ta. Asarwa Dist. Ahmedabad on the land bearing survey No.179 in the Registration sub- District and District Of Ahmedabad- 5(Narol) Was belonging to Purshottambhai Paragbhai Solanki be Gift Anil Purshottambhai Solanki with boundaries as under: East - House No.12P West - Wall North - House No.32 South - House No.35
8. BORROWER: MR. MURLI KHICHI & CO-BORROWER: MRS. CHAMPADHEVI KHICHI	Dt. 10/05/2024 & Rs.20,08,967/- A/C No. GJ/AMD/MAGR/A000000137	08-08-2024	All that piece and parcel of Non-Agricultural Immovable Property bearing Residential Tenement No.B/25 having admeasuring area admeasuring 60 Sq. Yards, in the Society known as "Sumeru Co-operative Housing Society Limited", in a Scheme known as "SUMERU". Constructed on Non- Agricultural land bearing Revenue Survey No.342 paiki (As per Revenue Record on 7/12, T.P.No.1 and F.P.96) situated, lying and being at Mouje: Ranip, Taluka: Sabarmati, in the Registration District Ahmedabad and Sub-District of Ahmedabad, and same is belonging to Champadevi Arjunsinh Khichi with boundaries as under: East - Society's Common Plot West - Society's Private Road North - Tenament No.24 South - Tenament No.26.
9. BORROWER: MR. PRAKASH DABHI & CO-BORROWER: MRS. PUSHPABEN DABHI	Dt. 10/05/2024 & Rs.21,64,676/- A/C No. GJ/AMD/CHDK/A000000027 & CO/CP/CP/CO/A000000017	08-08-2024	All parts and parcels of non-agriculture immovable Residential House on Plot No. 1/5 of Revenue Survey No. 368 Paikki, admeasuring total Land Area of 56.02 Sq. Mts., with Construction thereon land around 38.00 Sq. Mts., in Krishnanagar Vibhag-1, Near Bhavsar Hostel, Nava vadaj, Village Vadaj Taluka Sabarmati, Dist. Ahmedabad, Gujarat, Pin-380013 currently Owned and Possessed by Mrs. Kapilaben Natvarbhai Sharma and Mr. Nileshbhai Natvarbhai Sharma and Mr. Nikhil bhai Natvarbhai Sharma (Intends to purchase by Mr Prakashbha Jageshbhai Dabhi and Mrs. Pushpaben Prakashbhai Dabhi) with boundaries as: North:Plot No.1/6 South: Plot No.1/4 East:Internal Road West:Other Property.
10. BORROWER: MR. SANJAY DESAI & CO-BORROWER: MRS. SONALBEN DESAI & CO-BORROWER: MR. ISHWARBHAI DESAI	Dt. 10/05/2024 & Rs.15,62,822/- A/C No. GJ/AMD/CHDK/A000000088	08-08-2024	All part and parcel of non-agriculture Immovable property being Residential Flat No. B/G on Ground Floor, construction Adm. 78.44 Sq. Mts., with undivided share in the scheme of Karnavati (Paldi) Association known as "Kunthunath Apartment", in land of Final Plot No. 269 (As per AMC Tax Bill and Sale Deed) but Final Plot No. 268 (As per proposed plan and Rajachithi) of T.P. Scheme No. 6 paiki Sub-Plot No. 5 Adm. 654 Sq. Mts., situated at Mouje: Paldi, Taluka: Sabarmati, Registration Sub-District: Ahmedabad-4(Paldi), District: Ahmedabad, and Currently Owned and Possessed by Mr. Ishwerbhai Harjibhai Desai which is bounded as under, East - Main Gate, West - Behind Gate North - Approach Road South- Flat No.1 of Gujarat Society
11. BORROWER: MR. PRAKASH PARMAR & CO-BORROWER: MRS. ALKABEN DAHYALAL PARMAR & CO-BORROWER: DAHYABHAI PARMAR	Dt. 10/05/2024 & Rs. 14,46,138/- A/C No. GJ/AMD/CHDK/A000000155	08-08-2024	Property bearing Flat No. D-701 in Type-D, on 7th Floor (As per GUDA 7th Floor), admeasuring about 46.35 Sq.Mtrs Built-Up Area and 77.25 Sq. Mtrs Super Built-Up Area (Carpet area 37.02 Sq. Mtrs and Balcony area 2.31 Sq.Mtrs and wash area 2.50 Sq. Mtrs Total Carpet area 41.73 Sq. Mtrs) and undivided share 21. Sq. Mtrs. Area, in the scheme known as, "Gokul Residency", situated at Mouje Kolvada, Taluka. Gandhinagar, Dist. Gandhinagar on the land bearing Final plot No. 116 & 119 of T.P. Scheme No. 15 of Survey No. 1669/2&1669/5 in the Registration Sub-District of and District of Gandhinagar .was belonging to Ambica Developers a partnership firm to be Purchase by ALKABEN DAHYALAL PARMAR with boundaries as under: East - Survey No.1669-3 West - Flat No.702 North - Flat No.704 South - Raw House No.17
12. BORROWER: MR. VISHNUJI TALAJI THAKOR & CO-BORROWER: MRS. RAMILABEN VISHNUJI THAKOR	Dt. 10/05/2024 & Rs.12,22,736/- A/C No. GJ/MSN/HMTN/A000000011 & CO/CP/CP/CO/A0000001064	08-08-2024	all the piece and parcel of N. A. immovable property being Tenament No.7/20 of Gujarat Housing Board Scheme 410 E.W.S. of Shreenagar Society, admeasuring about 22.00 Sq. Mtrs., T. P. Scheme No. Sector 24, situated at Gandhinagar, District Gandhinagar, thereupon in the Sub-Registration District of Gandhinagar State of Gujarat and bounded as under :SURROUNDED ON EAST BY:Open Sky. SURROUNDED ON WEST BY: Tenament No.19. SURROUNDED ON NORTH BY: Open to Sky. SURROUNDED ON SOUTH BY: Open Space
13. BORROWER: MR. GOVINDBHAI SADHU & CO-BORROWER: MRS. NIRUBEN SADHU	Dt. 10/05/2024 & Rs.10,40,785/- A/C No. GJ/AMD/AHMD/A0000000419 & CO/CP/CP/CO/A000000069	08-08-2024	All part and parcels of Property bearing Plot No.291/1,admeasuring about 90.00 Sq. Mtrs. Plot area, and 57.20 Sq.Mtrs. Ground Floor area, situated at Mouje Gandhinagar, Sector 2-B,Tal. Gandhinagar, Dist. Gandhinagar in the land bearing Sector No. 2-B, and City Survey No.291/1 in Registration Sub- District and District Of Gandhinagar, was belonging to Mr.Govindbhai Atmaram Sadhu with boundaries as under: East: Plot No.292/2 West: 10.00 Mtrs. Road North: Plot No.290/2 South: Plot No.291/2

Place : GUJARATI
Date : 10-08-2024
Authorized officer
For, Hinduja Housing Finance Limited

LINK PHARMA CHEM LIMITED
Regd. Off.:162, GIDC Estate, Nandesari - 391 340., Dist. Vadodara Ph. : 0265-2840281
CIN : L24230GJ1984PLC007540, email id : linkpharmacs@gmail.com, www.linkpharmachem.co.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024
(Rs. in Lacs except EPS)

SR NO	Particulars	Quarter ended 30-06-2024 (Unaudited)	Quarter ended 31-03-2024 (Audited)	Quarter ended 30-06-2023 (Unaudited)	Year ended 31-03-2024 (Audited)
1.	Total Income from Operations	911.8	802.19	818.29	3053.80
2.	Net Profit/(Loss) for The Period (before Tax, Exceptional Items)	36.03	46.55	-114.21	-191.57
3.	Net Profit/(Loss) for The Period Before Tax (after Exceptional Items)	36.03	46.55	-114.21	-191.57
4.	Net Profit/(Loss) for The Period After Tax (after Exceptional)	29.64	26.00	-82.29	-136.29
5.	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after Tax))	30.50	37.31	-84.96	-133.04
6.	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	444.06	444.06	444.06	444.06
7.	Earnings Per Share (of Rs. 10/- Each) (For Continuing And Discontinued Operations)				
	1. Basic	Rs. 0.67	Rs. 0.59	Rs. -1.85	Rs. -3.07
	2. Diluted	Rs. 0.67	Rs. 0.59	Rs. -1.85	Rs. 3.07

NOTES: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange and the Company's website.

For Link Pharma Chem Limited
Satish G. Thakur
Chairman & Whole-Time Director
(DIN : 00292129)

Date : 09/08/2024
Place : Vadodara

SUNDARAM MUTUAL
Sundaram Finance Group

Notice cum Addendum to the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of the Scheme of Sundaram Mutual Fund

REVISION OF PRODUCT LABELLING ("RISK-O-METER") OF SCHEME OF SUNDARAM MUTUAL FUND
NOTICE is hereby given to the investors / unit holders that pursuant to SEBI circular no. SEBI/HO/IMD/DF3/CIR/P/2020/197 dated October 05, 2020 the Risk-o-meter of the scheme of Sundaram Mutual Fund ("the Fund") shall stand revised as under.

Name of the Scheme	Existing Risk-o-meter (Based on scheme portfolio as on June 30, 2024)	Revised Risk-o-meter (Based on scheme portfolio as on July 31, 2024)
Sundaram Ultra Short Duration Fund		

Investors are requested to note that, apart from the change in the Risk-o-meters as stated above, there is no other change in the scheme features including nature, investment objective, asset allocation pattern, terms and conditions of the above-mentioned Scheme.

All other terms and conditions of the Scheme Information Document(s) / Key Information Memorandum(s) / Statement of Additional Information will remain unchanged.

This addendum forms an integral part of the Scheme Information Document (SID) / Key Information Memorandum (KIM) / Statement of Additional Information (SAI) to the schemes of Sundaram Mutual Fund as amended from time to time.

For Sundaram Asset Management Company Ltd
R Ajith Kumar
Company Secretary & Compliance Officer

Place: Chennai
Date: August 10, 2024

For more information please contact:
Sundaram Asset Management Company Ltd
(Investment Manager to Sundaram Mutual Fund)
CIN: U93090TN1996PLC034615
www.sundarammutual.com
Regd. Office: No. 21, Patullos Road, Chennai 600 002.

Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully.

FRESHTRIP FRUITS LIMITED
CIN: L15400GJ1992PLC018365
Reg. Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015
Tel: 079 40307050-57, E-mail: info@freshtrop.com, Website: www.freshtrop.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2024
(Rs. in Lakhs)

Particulars	Quarter Ended			
	30.06.2024 (Unaudited)	31.03.2024 (Audited)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)
Total income from operations (net)	3,115.82	3,942.51	2,762.23	10,929.45
Net Profit for the period (before tax and exceptional items)	169.80	(59.95)	(121.50)	(676.17)
Net Profit for the period before tax (after exceptional items)	169.80	(59.95)	(121.50)	(676.17)
Net Profit for the period after tax (after exceptional items)	1,638.60	(20.57)	1,296.21	5,995.06
Total Comprehensive Income for the period	(4.86)	(10.25)	1.78	(16.89)
Profit/Loss for the period after comprehensive income	1,633.74	(30.82)	1,297.99	5,978.17
Equity Share Capital	796.99	989.49	989.49	989.49
Earning Per Share (Of Rs. 10 each) (after extraordinary items)				
Basic:	20.56	(0.21)	13.10	60.59
Diluted:	20.56	(0.21)	13.10	60.59

Notes:

- The above financial results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their meeting held on August 09, 2024.
- The result has been prepared in accordance with the Indian Accounting Standards ("Ind AS") as prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.
- The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on 30.06.2024, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange i.e. www.bseindia.com and also on the company's website www.freshtrop.com
- Previous Year's figures have been regrouped, reclassified wherever considered necessary.

For, Freshtrip Fruits Limited
Sd/-
Ashok Motiani
Managing Director

Place: Ahmedabad
Date: 09.08.2024

AstraZeneca
AstraZeneca Pharma India Limited
CIN: L24231KA1979PLC003563
Regd. Office : Block N1, 12th Floor, Manya Embassy Business Park, Rachenahalli, Outer Ring Road, Bangalore 560 045
Tel.: +91 80 6774 8000. Web: www.astrazeneca.com/india

Statement of unaudited financial results for the quarter ended 30 June 2024
Rs in million except for earnings per share data

Sl. No.	Particulars	3 months ended 30/06/2024	Corresponding 3 months ended in the previous year 30/06/2023	Year Ended 31/03/2024
		Unaudited	Unaudited	Audited
1	Total income from operations	3,958.7	3,035.7	13,303.3
2	Net profit / (loss) for the period from ordinary activities before tax	(151.6)	714.0	2,195.4
3	Net profit / (loss) for the period from ordinary activities after tax	(117.9)	538.6	1,615.1
4	Total comprehensive income / (loss) for the period after tax	(110.5)	543.2	1,625.1
5	Equity Share Capital	50.0	50.0	50.0
6	Other Equity	-	-	7,069.2
7	Basic and diluted earnings per share (of Rs 2 each)	(4.72)	21.54	64.60

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange websites (www.nseindia.com, www.bseindia.com) and Company's website (www.astrazeneca.com/india).
- The Statements of unaudited financial results have been prepared in accordance with the applicable Indian Accounting Standards notified under Section 133 of the Companies Act, 2013 [Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended)] and other accounting principles generally accepted in India.
- In continuation with the Company's earlier announcement of intent to exit its manufacturing site on 16 November 2023, the Company explored the option of sale of the manufacturing site in a fully operational manner to a Contract Manufacturing Organisation. The Company was unable to find a suitable one and has made an announcement to Stock exchanges on 21 June 2024 that it will now explore a buyer for its manufacturing site and exit in due course. The exit is estimated to take more than 12 months. Consequently, the company has accounted for provisions related to closure of its manufacturing site amounting to Rs.575.6 Million as exceptional item in the quarter ended 30 June 2024 as per the relevant Indian Accounting Standards.
- The Company has decided to change the rounding off principle followed in the Statement of financial results from lakhs of rupees to million of rupees from the current quarter.

By Order of the Board of Directors
For AstraZeneca Pharma India Limited
Sanjeev Kumar Panchal
Managing Director
DIN: 09823879

Place: Bangalore
Date: 8 August 2024

PUBLIC NOTICE FOR TITLE CLEARANCE

This public notice is hereby given to whomsoever may concern that Nileshbhai Limbabbhai Golakiya, the owner of the property bearing Plot No.: B/3 after construction as per site known as Bunglow No. 46/A (As per K.J.P. Block No. 287-30/B-3) of the society known as "Balaji Bungalows" admeasuring 75.28 Sq. Mtrs along with undivided proportionate share in Road-Rasta & COP land area 27.85 Square Meters total admeasuring 103.13 Sq. Mtrs situated on the land bearing Revenue Survey Nos : 260/1 & 261 paiki, Block No : 287 , T.P. Scheme No. 68 (Puna- Simada), Final Plot No. 88/A & 88/B of Village : Puna, Taluka : Puna (Surat city), District : Surat, asked for the title clearance certificate, it is submitted before me that the **Original Registration Fee Receipt of Registered sale deed No.: 10349 Dated : 14.10.2005 is misplaced.** If any person, Bank, or Financial institute has any interest in the said property, contact me at my address mentioned herein below within **7 DAYS** of publication of this notice with all relevant document. Upon expiration of the notice period, if no objection will be received by me, I will issue Title Clearance Report for the said property. Thereafter nobody has any right, interest in the said property and if anybody has any rights or interest in the said property, he/she has waived the said right. Subsequently No Objection will be considered. Please note. (Date : 10/08/2024)

JIGISHA KETAN SHAH (ADVOCATE)
Offi.: A-33, 3rd Floor, River palace, Beside Navdi Ovara, Nanpara, Surat, Mo.: 98252 94942

Bank of Baroda
Ranu Branch : Nr Panchayat Office, Ranu - 391445
Tal Padra Dist. Baroda, Gujarat India Phone No. 02662-223050, 8980875600 E-Mail ranu@bankofbaroda.com

POSSESSION NOTICE (For Immoveable property/ ies)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 24-05-2024 Calling upon the Borrower Shri MOHAMMADWASIM UMARBHAI SHAIKH to repay the amount mentioned in the notice being Rs. 15,78,455.24 (Rupees Fifteen Lakh Seventy Eight Thousand Four Hundred Fifty Five and Twenty Four paise only) as on 15-05-2024 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 5th day of August of the year 2024.

The Borrower/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount Rs. 15,78,455.24 (Rupees Fifteen Lakh Seventy Eight Thousand Four Hundred Fifty Five and Twenty Four paise only) and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immoveable Property

All that part and parcel of the Project/scheme known as "RIZWAN FLATS" being constructed / under construction on land bearing Revenue Survey No. 186 admeasuring 9207 Sq. Meters paiki Southern side admeasuring 3299 sq. Meters i.e. 35498 sq. feet R.S.No.20/21 admeasuring 4249 sq. mts., i.e. 45168.70 sq. Ft. Known as "Rizwan Flats" Tower B11, Fourth floor, flat no. 404, Super built up admeasuring 57.62sq Meters, i.e. 620 Sq. Ft. Mts. Mauje Tandajia at registration District & Sub District Vadodara within the state of Gujarat property bounded as under : On the North by: By Society Internal Road, On the South by: By Flat No B-11/403, On the East by: By Flat No B-11/401, On the West by: By Tower B-9.
Date: 05.08.2024
Place: Vadodara
Sd/- Chief Manager/Authorised Officer
Bank of Baroda

Central Bank of India
MAIN BRANCH, PORBANDAR

APPENDIX-IV (Rule 8 (1))
POSSESSION NOTICE (For Immoveable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the Central Bank of India, Main Branch Porbandar, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 07/02/2023 calling upon the Borrower M/s. Padmani Sea Food (Proprietor / Borrower), Prop. Mr. Naresh Ranchod Jungi, Mr. Ramjibhai Ranchhod Jungi (Guarantor / Mortgagor), Mrs. Lilavantiben Ramjibhai Jungi (Guarantor / Mortgagor) to repay the amount mentioned in the notice being Rs. 7,42,294.00 (Rupees Seven Lakh Forty Two Thousand Two Hundred Ninety Four Only) is due to us on 22.04.2024 within 60 days from the date of receipt of the said Notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section 4 of the Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules on this 5th Day of August of the year 2024.

The Borrower in particular and the Public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India Main Branch Porbandar for an amount Rs. 7,42,294.00 (Rupees Seven Lakh Forty Two Thousand Two Hundred Ninety Four Only) as on 22.04.2024 and interest thereon w.e.f. 23.04.2024.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Sl. No.	DESCRIPTION OF THE SECURED ASSETS / IMMOVABLE PROPERTY / MOVABLE PROPERTY
1	The Captioned Property situated Juribaug area in Porbandar City, Property Part and Partial of City Survey Ward No. 3, Survey No. 3476 paiki, Plot No. 341 paiki, Portion "B", it's land admeasuring 58-06 Sq. Mtrs., with existing structure thereon and Bounded as under: East : Road West : Property of Plot No. 382 North : Property of Plot No. 342 South : Remaining Captioned Property of Portion "A" holding by Bhurabhai Ramabhai Odedara's Property, Common Wall between them.

Date : 05/08/2024, Place : Porbandar Sd/- Authorised Officer, Central Bank of India

Bank of Baroda
BANK OF BARODA- TALSAT BRANCH
At- Talsat, P.O.- Atladra, Dist-Vadodara-390012, Gujarat, India. Mo. 9099975362, E-mail: talsat@bankofbaroda.com

APPENDIX IV [See Rule 8 (1)] POSSESSION NOTICE (For Immoveable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice Dated 17-05-2024 (Published in 02 Newspapers on 27-05-2024) calling upon the Borrowers/Guarantor/Mortgagor Mr. Vipulkumar Narendrabhai Patel & Mrs. Dhruviben Vipulbhai Patel to repay the amount mentioned in the notice being Rs. 52,08,350.34 (Rupees Fifty Two Lakh Eight Thousand Three Hundred Fifty and Paise Thirty Four Only) as on 14-05-2024 (Inclusive of Interest upto 14-04-2024) with further interest and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrowers/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 07th day of August of the year 2024.

The Borrowers/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, Talsat Branch for an amount of Rs. 52,08,350.34 (Rupees Fifty Two Lakh Eight Thousand Three Hundred Fifty and Paise Thirty Four Only) as on 14-05-2024 (Inclusive of Interest upto 14-04-2024) and interest plus other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description Of Immoveable Property

All that part & parcel of the Equitable Mortgage of property situated at Mouje Village Bill in the Registration Sub-District and District Vadodara bearing Revenue Survey No. 780, Block No. 561 area adm, 11736 Sq.Mtrs and Revenue Survey No. 781, Block No. 559 area adm. 3845 Sq.Mtrs NA land whereof as per plan, a scheme titled as "THE MARK" is develop consist on immovable residential property being Tower-E, 5th Floor, Flat No. 504 having construction carpet area of 139.35 Sq.Mtrs and undivided land area 62.63 Sq.Mtrs belonging to Mr. Vipulkumar Narendrabhai Patel & Mrs. Dhruviben Vipulbhai Patel, Bounded: North: Internal Road, South: Common Passage, East: Flat No. E-501, West: Tower-F.

Date: 07.08.2024
Place: Vadodara
Authorised Officer
Bank of Baroda

આદિવાસીઓ સહિત નેતાઓ અને સામાજિક આગેવાનોએ રેલીઓનું આયોજન

ભરૂચ જિલ્લાભરમાં વિશ્વ આદિવાસી દિવસની ડીજે અને ઢોલના તાલે ઉજવણી

ભરૂચ શહેર અને જિલ્લાભરમાં વિશ્વ આદિવાસી દિન નિમત્તે ઉજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત નેતાઓ અને સામાજિક આગેવાનોએ રેલીઓનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેરના રસ્તાઓ પર આદિવાસી વેશભૂષામાં આવી ઉજારોની સંખ્યામાં લોકોએ ડીજેના તાલે રેલીઓ યોજી હતી.



આદિવાસી વિસ્તારના સર્વોચ્ચ વિકાસ માટે રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના મંજૂરી કરાવી છે, નેત્રંગને મોડેલ તાલુકો બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓમાં ભારે ઉત્સાહ-ઉર્મંગનો માહોલ જોવા મળ્યો હતો. જે દરમિયાન પુર્વધારાસભ્ય મહેશ વસાવા, રાયસીંગ વસાવા, સેવંતુ વસાવા સહિતના આદિવાસી સમાજના આગેવાનો-યુવાનો જોડાયા હતા. બીજી તરફ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભવ્ય રેલીનું આયોજન કરતા ઉજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. સમગ્ર જિલ્લાભરમાં વિશ્વ આદિવાસી દિવસનું ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી હતી.

ચેક હવે બેંકમાંથી થોડા જ કલાકમાં ક્લિયર થઈ જશે

નવી દિલ્હી, તા.૮ રિઝર્વ બેંકની MPC મીટિંગમાં તેમની છેલ્લી જાહેરાતમાં RBI ગવર્નર સામાન્ય લોકો તેમજ વેપારી વર્ગને મોટી ભેટ આપી છે. RBI એ મોટો નિર્ણય લીધો છે કે હવે ચેક ક્લિયર થવામાં કેટલાક કલાક લાગશે જેમાં હાલમાં બે દિવસ વર્કિંગ ડે જેટલો સમય લાગે છે. ચેક ક્લિયર થવામાં 2 દિવસ જેટલો સમય લાગશે નહીં પરંતુ થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. તમારો ચેક આપ્યાના દિવસે જ ચેક ક્લિયર થઈ જશે અને તેમાં ફક્ત કેટલાક કલાકનો સમય લાગશે જેનાથી તમારા અનેક કામ સરળ થઈ જશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તેનો ફાયદો ચેક આપનાર અને પૈસા લેનાર એટલે કે ચેક આપનાર અને ચેક લેનાર બંનેને થશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપી થવાને કારણે બેંકિંગ પર પણ સકારાત્મક અસર પડશે.

Table with 5 columns: S.No., Particulars, Quarter ended 30-06-2024 (Unaudited), Quarter ended 31-03-2024 (Audited), Quarter ended 30-06-2024 (Unaudited), Year ended 31-03-2024 (Audited). Rows include Total Income from Operations, Net Profit/Loss, etc.

LINK PHARMA CHEM LIMITED

Table with 5 columns: SR No., Particulars, Quarter ended 30-06-2024 (Unaudited), Quarter ended 31-03-2024 (Audited), Quarter ended 30-06-2024 (Unaudited), Year ended 31-03-2024 (Audited). Rows include Total Income from Operations, Net Profit/Loss, etc.

મારું જૂનું નામ : કૃષિત કુમાર કુંદનકુમાર શેઠ, હવું જે બદલીને નવું નામ : કૃષિત કુંદનકુમાર શેઠ રાખેલ છે સરનામું : સી-68 શિવ રેસિડેન્સી વાઘોડિયા રોડ વડોદરા

I Have Changed My Name Qureshi Mohsinhussain Ibrahimhai To Qureshi Mohsin Ibrahimhai. Kagdihad, Machchipith, Raopura, Vadodara.

Bank of Baroda notice regarding the merger of the Gujarat branch into the Vadodra branch. Includes details about the merger date and branch closure.

જાહેર નિવેદન નંબર-૫૬/૭૨૦૨૪-૨૫. આથી રસ ધરાવતી સંસ્થા/ઉજારદાર/વ્યક્તિઓને જણાવવાનું છે કે, કેવડીયા વિલાસના કાર્યકર્તામાં આવતી સાલપુડા વેલી ચોક્કડ કલાવર્સ રેજ. વિંધ્યાચાલ વેલી ચોક્કડ કલાવર્સ રેજ અને હેઠીઝમ લાઇવલિવિડ અને સંકલન રેજના વિસ્તારમાં જુદા જુદા પ્રકારની વનીકરણને લગત કામગીરી સોન રેટ પર કરવા માટે ભાવો મંગાવવામાં આવે છે. આથી રસ ધરાવતી સંસ્થા/ઉજારદાર/વ્યક્તિઓએ (n) Procure (www.nprocure.com) સાઇટ પર જાહેરાત પ્રસિધ્ધ થયેલી દિન-૨૫ માં તેમનો ભાવો ઓન લાઇન આપવા વિનંતી છે.

વડોદરા મહાનગરપાલિકા અટલ ડ્રીજ નીચે આવેલ જગ્યામાં પે એન્ડ પાર્કનો ઇન્જો અહેર હસ્તગતી આપવા બાબત. વડોદરા મહાનગર પાલિકા હસ્તગતના મેડા સર્કલથી અક્ષર ચોક્કડ સુવીના અટલ ડ્રીજ નીચે આવેલ ખુદી જગ્યામાં પે એન્ડ પાર્કનો ઇન્જો માસિક લાયસન્સ ફી થી ૫ વર્ષની(એક)મુદત માટે અહેર હસ્તગતી આપવાનો હોઇ રજા ધરાવતી વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી નિયત અરજ પત્રકમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

Table with 4 columns: પાલિકા વિભાગ, સ્થળ, ડીપોઝીટની રકમ, મીનીમમઅપરોટ વેલ્યુ (પ્રતિ માસ). Rows include પાલિકા નં.૧૨ થી ૧૮, પાલિકા નં. ૩૨ થી ૩૩, etc.

જાહેર નોટીસ. આથી અમે એવોકેટ, ચાંદની વિકાસકુમાર લેખારાજની, ઠે. વડોદરા, અમારા અસીલ ડી. અનુપ શ્રીચંદ ચંદનાની, રે.ર. જયોતિ પાર્ક, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાછળ, ન્યુ સમા રોડ, વડોદરા- ૩૬૦૦૨૪ નાઓને યાદા સ્વામી સત્વંગ મુખ્ય મથક, બ્લાસ, પંજાબ દ્વારા વડોદરા એરીયાના એરીયા સેક્ટર ડી.૦૧/૧૨/૨૦૨૪ ના રોજ નિમણૂક કરવામાં આવેલ છે. જેથી તેઓને મળેલ સત્તા, અધિકારની રચ્ને તેઓ દ્વારા આપવામાં આવેલ માહિતી, સુચના અને તેઓની કરમાર્શથી આ જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, રજી.ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરા-૧, વડોદરા કરનાના રે.સ.નં.૮૨૨/૨ વાળી જમીનમાં આવેલ 'ડીસ્ટ્રીક્ટ વાઈલર જી.ઓ.હા.સો.લી. માં આવેલ પ્લોટ નં.બી-૧/૧ વાલો જેનું કુલ ક્ષેત્રફળ ૧૮૦૦ ચો.ફટ. છે તેમાં આશરે ૫૫૦ ચો.ફટ. જેટલું બાંધકામ કરવામાં આવેલ છે જેમાં ગ્રાહક રમ રસીડ, સંકાસ, બાઇચરમ આવેલ છે વાળી સ્થાયર મિલકત હાલમાં 'સાચા સ્વામી સત્વંગ બ્લાસ, પંજાબ ની માલીકી, કમ્પા, ભોળગુપ્તાવાળી આવેલ છે. સટરફ મિલકતના નીચે મુજબના અસલ દસ્તાવેજો અમારા અસીલશ્રીએ એક બેગમાં મુકેલ હતા અને એવોકેટ કમ્પાયા અર્થે સટર અસલ દસ્તાવેજો તારીખ : ૨૮/૦૭/૨૦૨૪ ના રોજ એક બેગમાં સાચે લઈ વારશીયા રીંગ રોડ ખાતે એવોકેટ કમ્પાયા માટે ગમેલા તે સમયે વારશીયા રીંગ રોડ સ્થિત શિવયાટીકા પાર્ટી પ્લોટ થી ગુરુકુલ સ્કુલની વચ્ચે સટરફ અસલ દસ્તાવેજો ક્યાક જોવાઈ ગયેલ છે / પડી ગયેલ છે જેની શોધ-ખોળ કરવા છતાં આજદીન સુધી મળી આવેલ નથી, જેથી તે અંગેની જાણ તેઓએ વારશીયા પોલીસ સ્ટેશ, વડોદરા ખાતે કરેલ છે.(૧) વેચાણ દસ્તાવેજ નં. ૪૮૧, તા.૧૮/૦૧/૧૯૯૯, (૨) વેચાણ દસ્તાવેજ નં. ૧૭૯૨૩, તા. ૧૭/૧૨/૧૯૯૧, (૩) વેચાણ દસ્તાવેજ નં.૧૦૦૯, તા. ૧૦/૦૨/૨૦૧૨, સુચન નં.૫૧૭૪, તા. ૨૭/૦૮/૨૦૦૧.ઉપરોક્ત વિગતે અમારા અસીલશ્રી પાસેથી સટરફ મિલકતના અસલ વેચાણ દસ્તાવેજો જોવાઈ ગયેલ / પડી ગયેલ હોય, જેથી જાહેર જનતાને વિનંતી કરવાની કે, કોઈપણ વ્યક્તિ / વ્યક્તિઓને સટરફ અસલ વેચાણ દસ્તાવેજો મળી આવે તો તાત્કાલીક એવોકેટ સી.વી.લેખારાજની નો સંપર્ક કરવા વિનંતી છે. તારીખ : ૧૦/૦૮/૨૦૨૪ C. V. LEKHRAJANI (ADVOCATES G.J.HIGH COURT) સ્થળ : વડોદરા.

કંપનીના નહી વટાવાયેલ ડિવિડન્ડ તથા ઇક્વિટી શેર ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ખાતે ટ્રાન્સફર કરવા બાબત. આથી સભાસદોને જણાવવામાં આવે છે કે, કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૧૨૪ (૬) ને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ઓથોરિટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર અને રીફંડ) નિયમો ૨૦૧૬ની સાથે વાચતા તેમજ વખતો વખત સુધારેલ નિયમો મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન જાહેર કરવામાં આવેલ ડિવિડન્ડ, જે સર્જા સાત (૭) વર્ષના સમયગાળા સુધી વટાવાયેલ નહી હોય તે, ભારત સરકાર દ્વારા નિયુક્ત IEPF ઓથોરિટી માં જમા કરાવી દેવામાં આવેલ છે. સટર ડિવિડન્ડ IEPF ઓથોરિટી એકાઉન્ટ માં જમા કરાવવાની નિયત તારીખ ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ છે. સટર નિયમો અંતર્ગત દર્શાવેલ કાર્યવાહી / કાર્યવિધિ મુજબ, સંબંધિત શેરો કે જેના પર સર્જા સાત (૭) વર્ષ સુધી ડિવિડન્ડ વટાવાયેલ ન હોય તેને સંલગ્ન શેરો પણ IEPF ઓથોરિટી ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે.

L&T Finance advertisement. Includes company logo, contact information, and details about financial services. Text: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વતી ચેતના ઇસ્તુયા કંપની સેક્રેટરી અને સીએમ (લીગલ) સ્થળ : નર્મદાનગર, ભરૂચ તારીખ : ૧૦ ઓગસ્ટ, ૨૦૨૪

INOX India Limited advertisement. Includes company logo, financial results table, and key highlights. Text: INOX India Limited Regd. Office: 9th Floor, K P Platina, Race Course, Vadodra - 390007. Table with 5 columns: SI No., Particulars, Quarter ended 30th June 2024, Quarter ended 30th June 2023, Year ended 31st March 2024. Key highlights include SAMEER exchange MOU, additional order for vacuum vessel, and received order for 86KL LH2 tank.